


એન.એ./એસ.આર./ ૧૨૭૭/૨૦૧૫-૧૬
 નં.જમીન-ડી/કલમ-૬૫/વશી/૨૨૦૮ થી ૨૨૧૬ /૧૬
 બીનખેતી શાખા, કલેક્ટર કચેરી, વડોદરા.
 તારીખ : ૧૬ /૦૪/૨૦૧૬

વંચાણમાં લીધા :-

- (૧) અરજદારશ્રી પ્રજાપતિ ગીરધરભાઈ અમરસીભાઈ વિગેરે રહે. ૨૯-ડી, સુવર્ણરેખા સોસાયટી, નિઝામપુરા, તા.જી.વડોદરાની તા.૦૪/૧૧/૧૫ ની અરજી તથા તા.૧૭/૦૨/૧૬ ની પુનઃ વિચારણા અરજી
- (૨) મામલતદારશ્રી, વડોદરા શહેર (પુર્વ) ના (૧) પત્ર નં.જમીન/ વશી/૭૮૫/૧૫ તા.૧૧/૧૨/૧૫ (૨) પત્ર નં.જમીન/વશી/૨૧૭/૧૬ તા.૧૬/૩/૧૬ થી રજુ થયેલ દરખાસ્ત/ અભિપ્રાય
- (૩) નાયબ કલેક્ટરશ્રી, જમીન સુધારણા, વડોદરાના પત્ર નં.ટેનન્સી/ એન.એ/વશી/૧૧૮/૧૬ તા.૧૦/૦૨/૧૬ થી રજુ થયેલ અભિપ્રાય.
- (૪) નગર નિયોજકશ્રી, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ, વડોદરાના પત્ર નં.યુડીએ/ પ્લાન-૨/૧૧૮૯ તા.૧૦/૧૧/૧૫
- (૫) જમીન સંપાદન અધિકારીશ્રીઓ (૧) નાયબ કલેક્ટરશ્રી વડોદરા (શહેર) ના પત્ર નં.જમીન/ વશી/૨૪૮૭/૧૫ તા.૧૧/૧૨/૧૫ (૨) નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી એકમ-૧, વડોદરાના પત્ર નં.જસં/ વળતર/ વશી/૧૪૦૯/૨૦૧૬ તા.૧૧/૦૧/૨૦૧૬ (૩) ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી, નર્મદા યોજના વડોદરાના પત્ર નં.જશ/ નં.યો./ વડોદરા/ વશી/ એસઆર/૧૩૫૭/૧૫ તા.૨૦/૧૧/૧૫ થી રજુ થયેલ અભિપ્રાયો.
- (૬) નગર રચના અધિકારીશ્રી એકમ-૩, વડોદરાના પત્ર નં.ક્રમાંક નરયો/બાપોદ-૪૩/ મુ.ખ.નં.૫૨/એકમ-૩/૨૮૭૨ તા.૧૮/૧૧/૧૫
- (૭) સક્ષમ અધિકારી અને નાયબ કલેક્ટરશ્રી (જ.સુ.) વડોદરાના પત્ર નં.યુ.એલ.સી./વશી/૨૦૫/૧૬ તા.૦૬/૦૨/૧૬ થી આવેલ અભિપ્રાય
- (૮) સરકારશ્રીના મહેસુલ વિભાગનો ઠરાવ ક્રમાંક : બખપ/૧૦૦૬/૪૨૫/ક, તા.૦૧/૦૭/૨૦૦૮
- (૯) તા.૨૧/૦૩/૧૬ ની કાર્યાલય નોંધ ઉપર અપાયેલ આદેશ



હુ ક મ :-

અરજદારશ્રી પ્રજાપતિ ગીરધરભાઈ અમરસીભાઈ વિગેરે રહે. ૨૯-ડી, સુવર્ણરેખા સોસાયટી, નિઝામપુરા, તા.જી.વડોદરાની મોજે બાપોદ તા.જિ.વડોદરાના સ.નં.૬૦૦, ટી.પી.સ્કીમ નં.૪૩ (બાપોદ), ફા.પ્લોટ નં.૫૨ ની ૮૦૧૯ જમીન પૈકી ૧૦૬૧.૨૯ ચો.મી વાણિજ્ય અને ૬૯૫૭.૭૧ ચો.મી. જમીનની રહેણાંકના હેતુસર બીનખેતીનો ઉપયોગ કરવા વંચાણ-૧ માં દર્શાવેલ અરજીથી માંગણી કરેલ છે.

મામલતદારશ્રી, વડોદરા શહેર (પુર્વ) વંચાણ-૨ ના પત્રથી અહેવાલ ચેકલીસ્ટ રજુ કરેલ છે. તેમજ સવાલવાળી જમીનનું ટાઈટલ કલીયર હોવા બદલ પ્રમાણપત્ર આપેલ છે. તેમજ સવાલવાળી જમીન સ્થળે ખુલ્લી હોઈ બીનખેતીની પરવાનગી આપવા માટે હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ છે.

નાયબ કલેક્ટરશ્રી, જમીન સુધારણા, વડોદરાએ વંચાણ-૩ થી સવાલવાળી જમીનના અરજદાર ખેડુત ખાતેદાર છે. બીનખેતી પરવાનગી આપવા અંગે ગણોત કાયદા અન્વયે હરકત સરખું ન હોવાનો હકારાત્મક અભિપ્રાય આપેલ છે.

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ, વડોદરાએ વંચાણ-૪ થી જી.ડી.સી.આરના ઝોનીંગ રેગ્યુલેશન મુજબ સવાલવાળી જમીનને અરજદારશ્રીની માંગણી મુજબના હેતુ માટે બિનખેતીની પરવાનગી આપવામાં આવે તો ઝોનની દૃષ્ટિએ વાંધા સરખું નથી, તેમ અભિપ્રાય આપેલ છે.

સંપાદન અધિકારીશ્રીઓના વંચાણ-૫ ના પત્રોથી સવાલવાળી જમીન અંગે તેઓની કચેરીમાં સંપાદનની કોઈ કાર્યવાહી ચાલુમાં નથી. તેમ જણાવેલ છે.



નગર રચના અધિકારીશ્રી નગર રચના યોજના, એકમ-૩, વડોદરાના વંચાણ-૬ ના પત્રથી જણાવ્યા મુજબ સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ મુસદ્દા રૂપ નગર રચના યોજના નંબર-૪૩ (બાપોદ) માં સમાવેશ થતાં સં.નં. ૬૦૦ ને મુ.ખ.નં. ૫૨ ની સામે આખરી નં. ૫૨ ફાળવવામાં આવેલ છે. તેમ જણાવેલ છે.

સક્ષમ અધિકારી અને નાયબ કલેક્ટરશ્રી (જ.સુ.) શ.જ.ટો.મ.ની કચેરી વડોદરાના વંચાણ-૭ ના પત્ર મુજબ રીપીલ એક્ટની જોગવાઈ નજરે સવાલવાળી જમીન અંગે રહેણાંક અને વાણિજ્યના હેતુ માટે બિનખેતીની પરવાનગી આપવામાં આવે તો હરકત સરખું ન હોવાનું જણાવેલ છે.

ઉપરોક્ત હકીકતે રજુ થયેલ અહેવાલ-અભિપ્રાય નજરે વંચાણમાં દર્શાવેલ સરકારશ્રીના ઠરાવની જોગવાઈઓ તથા ઉક્ત રજુ થયેલ અભિપ્રાયો ધ્યાને લઈ, અરજદારશ્રીની માંગણ મુજબ સવાલવાળી જમીનને બીનખેતીમાં ફેરવવા અંગેની માંગણી ગ્રાહ્ય રાખતાં, અરજદારશ્રી ને સદરહું જમીનના રૂપાંતરકરની રકમ, બીનખેતીની માપણી ફી તથા અન્ય ઉપકરો સરકારશ્રીમાં જમા કરાવવા જણાવતાં, અરજદારશ્રીએ રૂપાંતરકરની રકમ રૂ. ૧,૦૧,૪૧૬/- (અંકે રૂપિયા એક લાખ એક હજાર ચારસો સોળ પુરા) તથા બીનખેતી માપણી ફી રૂ. ૫૮,૮૦૦/- (અંકે રૂપિયા અઠાવન હજાર આઠસો પુરા) તા. ૦૫/૦૪/૧૬ ના રોજ તેમજ વિશેષધારો + લોકલ ફંડ રૂ. ૧૦,૬૮૨/- (અંકે રૂપિયા દસ હજાર છસો બાણું પુરા) શિક્ષણ ઉપકર રૂ. ૧,૭૮૮/- (અંકે રૂપિયા એક હજાર સાતસો ઈઠીયાસી પુરા) તા. ૦૪/૦૪/૧૬ ના રોજ તલાટીશ્રી, બાપોદ દ્વારા સરકારશ્રીમાં વસુલ લેવાયેલ છે, તેની અસલ પહોંચો રજુ કરેલ છે.

સબબ ઉપરોક્ત હકીકતે મુંબઈ જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫ અન્વયે સવાલવાળી મોજે બાપોદ તા. જિ. વડોદરાના સ.નં. ૬૦૦, ટી. પી. સ્કીમ નં. ૪૩ (બાપોદ), ફા. પ્લોટ નં. ૫૨ ની ૮૦૧૯ જમીન પૈકી ૬૮૫૭.૭૧ ચો. મી. રહેણાંક અને ૧૦૬૧.૨૯ ચો. મી. વાણિજ્ય હેતુ માટે બીનખેતીનો ઉપયોગ કરવા, નીચેની શરતોને આધીન પરવાનગી આપવામાં આવે છે.

શ ર તો :-



- (૧) ડીસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ્સ દ્વારા ઈસ્યુ કરાયેલ માપણી શીટ કે જેના ઉપર મૂળ ટિપ્પણની હદ પણ દર્શાવેલ હોવી જોઈએ. રજૂ કરાયેલ પ્લાન તથા લે-આઉટ પ્લાન સક્ષમ કક્ષાએ મંજૂર કરાવેલ હોવો જોઈશે.
- (૨) બાંધકામ શરૂ કરતાં પહેલાં બાંધકામના નકશા સક્ષમ અધિકારી પાસે મંજૂર કરાવવાના રહેશે, પરંતુ અરજદાર બિનખેતી પરવાનગી મેળવ્યા વગર આવા બાંધકામની રજા ચીટી મેળવી શકશે નહીં.
- (૩) શહેરી વિસ્તાર જ્યાં ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થઈ ગઈ છે ત્યાં જી. ડી. સી. આર. અને ઝોનીંગના નિયમો અનુસાર બાંધકામ કરવાનું રહેશે.
- (૪) મંજૂર થયેલ નકશા મુજબ આરોગ્ય અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગંદા પાણીના નિકાલની જોગવાઈ કરવાની રહેશે.
- (૫) અરજદારે રીબન ડેવલપમેન્ટ રૂલ્સ નીચે જે તે રસ્તાનો પ્રકાર ધ્યાને લઈ રસ્તાના મધ્યભિંદુથી બાંધકામ વચ્ચે અંતર જાળવવાનું રહેશે અન્યથા અરજદારની જવાબદારી થશે.
- (૬) ઔદ્યોગિક હેતુ માટે મંજૂરી માંગેલ હોય તો બાંધકામ કરતાં પહેલાં જિલ્લા ઉદ્યોગ અધિકારીશ્રીની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- (૭) સવાલવાળી જમીન જો જેલથી નજીક હોય તો ૧૮૪ મીટરનું અંતર છોડી બાંધકામ કરવાનું રહેશે.
- (૮) સવાલવાળી જમીન જો રેલ્વે હદની નજીક હોય તો રેલ્વેની હદથી ૩૦ મીટર જગ્યા છોડી બાંધકામ કરવાનું રહેશે.
- (૯) સવાલવાળી જમીન ઉપરથી અથવા બાજુમાંથી વિજળી ગ્રીડના તાર/ હાઈટેન્શન પાવર અગર થાંભલા આવેલ હોય ત્યારે તે અન્વયે લાગુ પડતા નિયમોનું પાલન કરવાનું અને તે મુજબ બાંધકામ કરવાનું રહેશે.
- (૧૦) બિનખેતી માંગવામાં આવી હોય તેવી જમીન જો એરોડ્રામ આસપાસના ૨૦ કી. મી. ની ત્રિજ્યામાં આવતી હોય ત્યારે બાંધકામની ઉચાઈ તથા એરોડ્રામની દ્રષ્ટિએ જરૂરી એવું 'ના લાંબા પ્રમાણપત્ર' સીવીલ એવીએશન ખાતા પાસેથી મેળવવાનું રહેશે અને સીવીલ એવીએશન ખાતાના નિયમોનું પાલન કરવાનું રહેશે.




- (૧૧) ભારતીય વાયુસેનાના હવાઈ મથક તથા ઈન્સ્ટોલેશનથી બાંધકામ કરવાની મર્યાદા ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેરનામાથી વખતોવખત બહાર પાડવામાં આવે તેટલી ત્રિજ્યા બહાર બાંધકામ કરવાનું રહેશે.
- (૧૨) ઓ.એન.જી.સી.ના કુવા નજીકમાં આવેલ જમીનના કિસ્સામાં અરજદારે સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે.
- (૧૩) નર્મદા કેનાલ/અન્ય સિંચાઈ કેનાલની નજીકમાં આવેલ જમીનની બાબતમાં અરજદારે સૂચિત બાંધકામ માટે જાળવવાના થતાં અંતર અંગેના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- (૧૪) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કાયદા નીચે રક્ષિત સ્મારક (PROTECTED MONUMENTS) તરીકે જાહેર કરેલ પ્રાચીન સ્મારકથી ૧૦૦ મીટર સુધીનું અંતર જાળવવાની પ્રવર્તમાન જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
- (૧૫) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં ભારતીય વન અધિનિયમ હેઠળ અનામત વન જમીન કે રક્ષિત વન તરીકે જાહેર કરેલ વન/જમીનથી જાળવવાના થતાં અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
- (૧૬) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અન્વયે અભ્યારણ્ય અથવા રાષ્ટ્રીય ઉપવન તરીકે જાહેર કરેલ કોઈપણ વિસ્તારની હદથી જાળવવાના થતાં અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

અરજદારે ઉપરોક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમાં નિષ્ફળ જશે તો, શરતભંગ ગણી સક્ષમ અધિકારી કાયદેસરની કાર્યવાહી કરશે.

વધુમાં અરજદારશ્રીએ નીચેની શરતોનું પણ પાલન કરવાનું રહેશે.

- (૧૭) બાંધકામ શરૂ કર્યા તારીખથી એક માસમાં અને બાંધકામ પુરૂ કર્યા તારીખથી એક માસમાં એમ બન્ને પ્રસંગોએ અત્રે લેખિતમાં જાણ કરવી પડશે.
- (૧૮) આ જમીન ઉપરનું મંજૂર થયા પ્રમાણે બાંધકામ આ હુકમ થયા તારીખથી છ માસમાં શરૂ કરી ત્રણ વર્ષમાં પુરૂ કરવાનું રહેશે. તેમ કરવામાં ચુક થયે કલમ-૬૭ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને વસુલ ભરેલો વિ.ધારો વિગેરે કોઈપણ સંજોગોમાં પરત મેળવવાનો હકક રહેશે નહિ. આ અંગે અપીલનો સમય પૂરા થયા બાદ કોઈ હકક રહેશે નહિ.
- (૧૯) રજાચિઠ્ઠી, લેઆઉટ પ્લાન વિરુદ્ધ બાંધકામ થયાનાં પ્રસંગે કલેક્ટરશ્રી હુકમ કરે તે સમયમાં દૂર કરવાનું રહેશે. અને તે વિરુદ્ધ વર્તન થયાનાં પ્રસંગે કબજેદારને ખર્ચે બાંધકામ દૂર કરાવવામાં આવશે અને ખર્ચ જમીન મહેસુલ બાકી રાહે વસુલ કરવાપાત્ર થશે. કલેક્ટરશ્રી ઠરાવે તે દંડ ભરવો પડશે.
- (૨૦) હુકમ થયા તારીખથી છ માસની અંદર કબજેદારે જમીન મહેસુલ કાયદામાં જણાવ્યા મુજબ નમુના "એમ" માં સનદ ભરી આપવાની રહેશે. તે વિરુદ્ધ વર્તન થયાનાં પ્રસંગે કલેક્ટરશ્રી ઠરાવે તે દંડ ભરવાનો રહેશે. ઉક્ત સનદ અપીલનો સમય પુરો થયા બાદ ભરી આપવાની રહેશે.
- (૨૧) જે હેતુનું બાંધકામ પુરૂ થયેથી એક માસની અંદર તેની જાણ પરવાનગી આપનાર અધિકારીને કબજેદારે કરવાની રહેશે.
- (૨૨) આ જમીનની જે હેતુ માટે પરવાનગી આપી છે તે હેતુ સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ કરતાં પહેલાં કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહેશે. તે વિરુદ્ધ વર્તન થયાના પ્રસંગે લે.રે.કોડની કલમ-૬૭ મુજબ પગલાં લેવામાં આવશે.
- (૨૩) "વરસાદી પાણીના ભૂગર્ભ વહન/સંચય માટે દર મકાન/બહુમાળી મકાન (નકશા મંજૂર કરવાની સત્તા ધરાવતા સત્તાતંત્રએ આપેલ મંજૂરી મુજબ) દીઠ એકના દરે પરકોલેટીંગ બોરની વ્યવસ્થા અચૂક કરવાની રહેશે."
- (૨૪) જમીન ધારકશ્રીએ સક્ષમ સત્તાધિકારીશ્રી તરફથી મંજૂર થયેલ સૂચિત નકશા અને રજાચિઠ્ઠી મુજબ બાંધકામ કરવાનું રહેશે. તેમજ રજાચિઠ્ઠી / વિકાસ પરવાનગીમાં જણાવેલ શરતોનું પાલન કરવાનું રહેશે તેમજ મંજૂર થયેલ રજાચિઠ્ઠી તથા નકશાની નકલ દિન-૩૦ માં રજુ કરવાની રહેશે.
- (૨૫) બાંધકામ પરવાનગી સંબંધી લે-આઉટ પ્લાન મંજૂર કરાવતી વખતે વુડાએ કરેલા જી.ડી.સી.આરના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- (૨૬) વુડાના જી.ડી.સી.આરના ઝોનીંગ રેગ્યુલેશન મુજબ બાંધકામની પરવાનગી મેળવ્યા બાદ જ અરજદારે બાંધકામ શરૂ કરવાનું રહેશે.





- (૨૭) આ જમીનનો વિશેષધારો, લોકલ ફંડ તથા શિક્ષણ ઉપકર પ્રવર્તમાન દરે હુકમની તારીખના મહેસુલી વર્ષથી આ સાથે સામેલ પત્રક મુજબનો ભરવાનો રહેશે.
- (૨૮) સવાલવાળી જમીન અંગે અરજદારશ્રીએ રજુ કરેલ સુચિત લે-આઉટ પ્લાનમાં દર્શાવ્યા પ્રમાણે રસ્તા પૈકીની જમીન, કોમન પ્લોટની જમીન અને સહીયારા ઉપયોગ માટે ખુલ્લી રાખેલ જમીનનું કોઈપણ રીતે વેચાણ થઈ શકશે નહીં.
- (૨૯) ઉપરની કોઈપણ શરત અગર સનદમાં જણાવેલી શરતો પૈકી કોઈપણ શરતનો ભંગ થયા પ્રસંગે જમીન મહેસુલ કાયદામાં જણાવેલી શિક્ષાને કબજેદાર પાત્ર અને તેનો બાધ લીધા સિવાય કલેક્ટરશ્રી જે પગલાં લેશે તે કબજેદારને બંધનકર્તા રહેશે.

રવાના કર્યું
મામલતદાર (બિનખેતી)
કલેક્ટર કચેરી, વડોદરા



સહી/-
(અવંતિકા સિંઘ)
કલેક્ટર વડોદરા

પ્રતિ,

- (૧) શ્રી ગીરધરભાઈ અમરશીભાઈ પ્રજાપતિ
- (૨) શ્રી પ્રેમજીભાઈ રાવજીભાઈ
- (૩) શ્રી નિલમબેન તે ગિરધરભાઈ અમરશીભાઈની દિકરી અને જીન્નેશભાઈ પ્રકાશભાઈની પત્ની
- (૪) શ્રી ભારતીબેન તે ધરમશીભાઈ નરસિંહભાઈની દિકરી અને ભાવિનભાઈ દિનેશભાઈની પત્ની
- ૨૯-ડી, સુવર્ણરેખા સોસાયટી,
નિઝામપુરા,
તા.જી.વડોદરા.

નકલ રવાના :-

- મામલતદારશ્રી, વડોદરા શહેર (પુર્વ) તરફ હુકમની શરતોનો નોંધમાં ઉલ્લેખ કરી નોંધ પાડવા તથા નોંધ, ૭/૧૨ ની નકલ સહ જાણ કરવા સારું.
- મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા મહાનગર સેવાસદન, ખંડેરાવ માર્કેટ, વડોદરા તરફ જાણ સારું.
- જિલ્લા નિરીક્ષકશ્રી, જમીન દફતર / સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટશ્રી નં. ૧, ૨, ૩, ૪ વડોદરા તરફ...
- તલાટી કમ મંત્રીશ્રી બાપોદ, તા.વડોદરા તરફ હુકમ મુજબ અમલવારી કરવા સારું
- જન સેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, વડોદરા તરફ જરૂરી કાર્યવાહી કરવા સારું.
(BAR CODE NO.17508)
- રેકર્ડ શાખા
- સિલેક્ટ ફાઈલ


મોજે બાપોદ તા.જિ.વડોદરાના સ.નં.૬૦૦, ટી.પી.સ્કીમ નં.૪૩ (બાપોદ), ફા.પ્લોટ નં.૫૨ ની ૮૦૧૯ જમીન પૈકી ૧૦૬૧.૨૮ ચો.મી વાણિજ્ય ૬૮૫૭.૭૧ ચો.મી.જમીનની બીનખેતીની પરવાનગી અનુસાર વસુલ કરવાના રૂપાંતરકર, વિશેષધારો, લોકલ ફંડ, શિક્ષણઉપકરની વિગત દર્શાવતું પત્રક

બીનખેતીની પરવાનગી માંગેલ જમીનનો સ.નં., ક્ષેત્રફળ તથા કબજેદારનું નામ				બીનખેતીની પરવાનગી માંગેલ જમીનનું ક્ષેત્રફળ	નિયમ મુજબ લેવાનો વિશેષ ધારાની રકમ	વસુલ કરવાની વિશેષ ધારાની રકમ	રૂપાંતરકર લેવાની રકમ રહેણાંક હેતુ માટે પ્રતિ ચો.મી.ના રૂ. ૧૦/- તથા વાણિજ્ય હેતુ માટે પ્રતિ ચો.મી.ના રૂ. ૩૦/- પ્રમાણે રૂ. પૈસા	લોકલ ફંડની વિગત (વિશેષધારા ના ૦.૫૦ પૈસા) રૂ. પૈસા	શિક્ષણ ઉપકરની રકમ (વિશેષધારાના ૦.૨૫ પૈસા) રૂ. પૈસા	વિ.ધારો ક તારીખથી લેવાનો છે તેની વિગત
૧				૨	૩	૪	૫	૬	૭	૮
મોજે બાપોદ તા.વડોદરા				૬૮૫૭.૭૧ ચો.મી. (રહેણાંક)	રહેણાંકના હેતુના દરે દર ચો.મી.ના ૦-૨૫ પૈસા પ્રમાણે	૧,૭૩૮/- (અંકે રૂપિયા એક હજાર સાતસો ઓગણ ચાલીસ પુરા)	૬૮,૫૭૭/- (અંકે રૂપિયા ઓગણ સીતેર હજાર પાંચસો સીત્યોતેર પુરા)	૮૭૦/- (અંકે રૂપિયા આઠસો સીતેર પુરા)	૪૩૫/- (અંકે રૂપિયા ચારસો પાંત્રીસ પુરા)	હુકમની તારીખના મહેસુલી વર્ષથી
કબજેદારશ્રી :-				૧૦૬૧.૨૮ ચો.મી. (વાણિજ્ય)	વાણિજ્ય હેતુના દરે દર ચો.મી.ના ૦-૬૦ પૈસા પ્રમાણે	૬૩૭/- (અંકે રૂપિયા છસો સાડત્રીસ હજાર પુરા)	૩૧,૮૩૮/- (અંકે રૂપિયા એકત્રીસ હજાર આઠસો ઓગણ ચાલીસ પુરા)	૩૧૮/- (અંકે રૂપિયા ત્રણસો ઓગણીસ પુરા)	૧૬૦/- (અંકે રૂપિયા એકસો સાઈઠ પુરા)	
(૧) શ્રી ગીરધરભાઈ અમરશીભાઈ પ્રજાપતિ (૨) શ્રી પ્રેમજીભાઈ રાવજીભાઈ (૩) શ્રી નિલમબેન તે ગિરધરભાઈ અમરશીભાઈની દિકરી અને જીનેશભાઈ પ્રકાશભાઈની પત્ની (૪) શ્રી ભારતીબેન તે ધરમશીભાઈ નરસિંહભાઈની દિકરી અને ભાવિનભાઈ દિનેશભાઈની પત્ની				૮૦૧૯ ચો.મી.		૨,૩૭૬/- (અંકે રૂપિયા બે હજાર ત્રણસો છોતેર પુરા)	૧,૦૧,૪૧૬/- (અંકે રૂપિયા એક લાખ એક હજાર ચારસો સોળ પુરા)	૧,૧૮૮/- (અંકે રૂપિયા એક હજાર એકસો નેવ્યાંસી પુરા)	૫૮૫/- (અંકે રૂપિયા પાંચસો પંચાણ્ણ પુરા)	

નોંધ:- રૂપાંતરકરની રકમ રૂ. ૧,૦૧,૪૧૬/- (અંકે રૂપિયા એક લાખ એક હજાર ચારસો સોળ પુરા) તા. ૦૫/૦૪/૨૦૧૬ ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં "૦૦૩૫" સદરે જમા કરાવી અસલ ચલન રજુ કરેલ છે.

રવાના કર્યું

મામસતદાર/બિનખેતી
ક્લેકટર/ચેરી, વડોદરા



સહી/-
(અવંતિકા સિંઘ)
ક્લેકટર વડોદરા